



**Vidhyayana - ISSN 2454-8596**

An International Multidisciplinary Peer-Reviewed E-Journal

[www.j.vidhyayanaejournal.org](http://www.j.vidhyayanaejournal.org)

Indexed in: ROAD & Google Scholar

---

## LIFE SKILL EDUCATION

**RESEARCHER**

**DR. ROHIT C. PATEL**

**(M.COM., M.ED., PH.D.)**

**Lecturer, District Institute Of Education And Training, Navsari**



## સારાંશ/Abstract

જીવનમાં ભવિષ્યમાં શું થશે, કેવી સમસ્યા આવશે, કેવા પડકારો આવશે, તેમજ કેવી તકો આપશે તે અંગે કોઈ જાણી શક્યું નથી. તેથી જીવનમાં ભવિષ્યમાં આવી પડનારી સમસ્યાઓ કે પડકારો સામે ટકવાનું છે અને સફળ જીવન જીવવા માટે ભવિષ્યમાં આવનારી તકોનો પણ લાભ લેવાનો છે. મનુષ્યના જીવનમાં આ બધું આપમેળે નહીં થતું. માણસે તેના માટે તૈયાર થવું પડતું હોય છે. તૈયારી માણસે જાતે કરવી પડતી હોય છે. જીવન કૌશલ્ય એ હકારાત્મક વર્તન અને અનુકૂલન માટેની ક્ષમતાઓ છે જે વ્યક્તિત્વે તેના રોઝંડા જીવનમાં આવતી સમસ્યાઓ, જરૂરીયાતો અને પડકારો સામે અસરકારક રીતે લડવા સક્ષમ બનાવે છે. જીવન કૌશલ્ય શિક્ષણ એટલે વિદ્યાર્થીની જરૂરિયાતોનો વિકાસ અને આંકાશાઓ પૂરી કરવા માટેનું શિક્ષણ તેમ જ ભવિષ્યની સમસ્યાઓ અને પડકારો સામે ટકવા માટેનું શિક્ષણ. આવા દસ પ્રકારના જીવન કૌશલ્યોની અહીં ચર્ચા કરવામાં આવી છે. સમસ્યા ઉકેલ કૌશલ્ય, પ્રત્યાયનનું કૌશલ્ય, સર્જનાત્મક વિચારસરણી, નિર્ણયીકરણ, હકારાત્મક અને વૈજ્ઞાનિક દાખિકોણ, સહાનુભૂતિ, આંતર વ્યક્તિત્વ સંબંધ, તાણ, ચિંતા અને દબાણજન્ય પરિસ્થિતિમાં સંતુલન અને સ્વ-જાગૃત સ્વની ઓળખ જેવા કૌશલ્યોની અહીં ચર્ચા કરવામાં આવી છે. વ્યક્તિત્વે જીવન કૌશલ્ય શાળા કોલેજના શિક્ષણ દ્વારા તેણે મેળવવાનું હોય છે. આવા મહત્વના જીવન કૌશલ્ય વિશે અત્રે ચર્ચા કરવામાં આવી છે. જેથી વિદ્યાર્થી જીવન ઘડતરના પથ પર સરળતાથી ચાલી શકે અને સફળ જીવન જીવી સમસ્યાઓ અને સંઘર્ષો સામે હાર ન માનતા ટકી રહેવાનું શીખે.

### ૧. પ્રસ્તાવના :-

ના જાણ્યું જાનકીનાથે કાલે સવારે શું થવાનું? જીવનમાં ભવિષ્યમાં શું થશે, કેવી સમસ્યા આવશે, કેવા પડકારો આવશે, તેમજ કેવી તકો આપશે તે અંગે કોઈ જાણી શક્યું નથી. તેથી જીવનમાં ભવિષ્યમાં આવી પડનારી સમસ્યાઓ કે પડકારો સામે ટકવાનું છે અને સફળ જીવન જીવવા માટે ભવિષ્યમાં આવનારી તકોનો પણ લાભ લેવાનો છે. મનુષ્યના જીવનમાં આ બધું આપમેળે નહીં થતું. માણસે તેના માટે તૈયાર થવું પડતું હોય છે. તૈયારી માણસે જાતે કરવી પડતી હોય છે. જીવન કૌશલ્ય એ હકારાત્મક વર્તન અને અનુકૂલન માટેની ક્ષમતાઓ છે જે વ્યક્તિત્વે તેના રોઝંડા જીવનમાં આવતી સમસ્યાઓ, જરૂરીયાતો અને પડકારો સામે અસરકારક રીતે લડવા સક્ષમ બનાવે છે. જીવન કૌશલ્ય શિક્ષણ એટલે વિદ્યાર્થીની જરૂરિયાતોનો વિકાસ અને આંકાશાઓ પૂરી કરવા માટેનું શિક્ષણ. આવા દસ પ્રકારના જીવન કૌશલ્યોની અહીં ચર્ચા કરવામાં આવી છે. સમસ્યા ઉકેલ કૌશલ્ય, પ્રત્યાયનનું કૌશલ્ય, સર્જનાત્મક વિચારસરણી, નિર્ણયીકરણ, હકારાત્મક અને વૈજ્ઞાનિક દાખિકોણ, સહાનુભૂતિ, આંતર વ્યક્તિત્વ સંબંધ, તાણ, ચિંતા અને દબાણજન્ય પરિસ્થિતિમાં સંતુલન અને સ્વ-જાગૃત સ્વની ઓળખ જેવા કૌશલ્યોની અહીં ચર્ચા કરવામાં આવી છે. વ્યક્તિત્વે જીવન કૌશલ્ય શાળા કોલેજના શિક્ષણ દ્વારા તેણે મેળવવાનું હોય છે. આવા મહત્વના જીવન કૌશલ્ય વિશે અત્રે ચર્ચા કરવામાં આવી છે. જેથી વિદ્યાર્થી જીવન ઘડતરના પથ પર સરળતાથી ચાલી શકે અને સફળ જીવન જીવી સમસ્યાઓ અને સંઘર્ષો સામે હાર ન માનતા ટકી રહેવાનું શીખે.

ભવિષ્ય માટેની તૈયારી માણસ કરી લે તો જીવન સરળ બની જાય છે મનુષ્ય પોતાના જીવનનો આસ્વાદ લઈ શકે અને જે હેતુસર જીવન તેને મળ્યું હોય તે હેતુ પરિપૂર્ણ થાય. આ માટે માણસ પાસે જીવન જીવવાનું કૌશલ્ય હોવું જોઈએ. જીવન જીવવા માટે કયા કૌશલ્યની જરૂર પડે તે માણસને ખબર હોવી જોઈએ. એકવાર ખબર પડી જાય કે પોતાના જીવનમાં કયા કૌશલ્યોની જરૂર છે પછી મનુષ્ય જીવના સંઘર્ષો સામે ટકતો થઈ જાય છે.

જીવન કૌશલ્ય વિશે જાણનાર જરૂરથી જીવનમાં નાસીપાસ થતો નથી પરંતુ જીવન જીવવા માટે સજજ થઈ જાય છે. કૌશલ્યની જાણકારી અને તેનું અનુરૂપ જીવન જીવવા માટેની તૈયારી એટલે જીવન જીવવાની સજજતા. મનુષ્યે ઘણા પ્રકારે જીવન જીવવાનું હોય છે. પારિવારીક જીવન, સામાજિક જીવન, વ્યવસાયિક જીવન અને વ્યક્તિગત જીવન. માણસે વ્યક્તિગત જીવન જીવવા માટે ઘણા કૌશલ્યની જરૂર પડતી હોય છે અને અન્ય પ્રકારના જીવનની સફળતાનો આધાર પણ વ્યક્તિગત જીવનની સફળતા પર જ રહેલો છે. વ્યક્તિત્વે જીવન કૌશલ્ય શાળા કોલેજના શિક્ષણ દ્વારા તેણે મેળવવાનું હોય છે. આવા મહત્વના જીવન કૌશલ્ય વિશે અત્રે ચર્ચા કરવામાં આવી છે. જેથી વિદ્યાર્થી જીવન ઘડતરના પથ પર સરળતાથી ચાલી શકે અને સફળ જીવન જીવી સમસ્યાઓ અને સંઘર્ષો સામે હાર ન માનતા ટકી રહેવાનું શીખે.



## ૨. જીવન કૌશલ્ય :-

જીવન કૌશલ્ય કોને કહેવાય તે અંગે અહીં કેટલીક ચર્ચા કરવામાં આવી છે.

WHO દ્વારા જીવન કૌશલ્ય અંગે નીચે મુજબ વ્યાખ્યા આપેલ છે.

“ જીવન કૌશલ્ય એ હકારાત્મક વર્તન અને અનુકૂલન માટેની ક્ષમતાઓ છે જે વ્યક્તિને તેના રોજંદા જીવનમાં આવતી સમસ્યાઓ, જરૂરીયાતો અને પડકારો સામે અસરકારક રીતે લડવા સક્ષમ બનાવે.”

UNICEF (૨૦૦૦) માં નીચે મુજબ વ્યાખ્યા આપેલ છે.

“ જીવન કૌશલ્ય એટલે વર્તન પરિવર્તન અથવા વર્તન વિકાસ અભિગમ.”

“ જીવન કૌશલ્યએ ગ્રાણ ક્ષેત્રોના સંતુલનને ધ્યાનમાં લેવા માટે રચાયેલ છે. જ્ઞાન, વલશ અને કૌશલ્ય.”

“ જીવન કૌશલ્ય એટલે વ્યક્તિને માત્ર સારા ભવિષ્ય માટે તૈયાર કરવાનું જ નહિં પરંતુ તેની કાર્યક્ષમતામાં પણ સુધારો વધારો કરવાનું છે.”

“ જીવન કૌશલ્ય તાણના સમયમાં ઘટાડો, હકારાત્મક દસ્તિક્રાણ અને ભાવી યોજાનના ઘડતરની ક્ષમતા છે. જે ભાવિ લક્ષ્યાંકોને હાંસલ કરવા માટે મદદરૂપ બની કાર્યક્ષમતામાં વધારા કરે છે.”

“ જીવન કૌશલ્ય એ વ્યક્તિગત છે. જે વ્યક્તિના સ્વને અભિવ્યક્ત કરે છે.”

## ૩. જીવન કૌશલ્ય શિક્ષણ એટલે શું?

જીવન કૌશલ્ય શિક્ષણ એટલે.....

- વિદ્યાર્થીની જરૂરિયાતોનો વિકાસ અને આંકાશાઓ પૂરી કરવા માટેનું શિક્ષણ.
- ભવિષ્યની સમસ્યાઓ અને પડકારો સામે ટકવા માટેનું શિક્ષણ.
- ભાવિ તકો સાંપડવા માટેનું શિક્ષણ.
- વ્યક્તિ ઘડતર, સુટેવોનું ઘડતર, વર્તન ઘડતર અને વલશ ઘડતરનું શિક્ષણ.
- ક્ષમતાઓ વધારવા અને પસંદગીનો અવકાશ વધારવાનું શિક્ષણ.
- ભાવિ જીવનની તૈયારી માટેનું શિક્ષણ.

## ૪. જીવન કૌશલ્ય શિક્ષણના હેતુઓ

1. વિદ્યાર્થીઓના ચારિત્ર્ય વિકાસ માટે.
2. ૪-h દ્વારા વિકસિત જીવન કુશળતાઓનો ઓળખવા.
3. વ્યાવહારિકતા વિકસાવવા માટે.



4. વિદ્યાર્થીઓનો સામાજિક, વ્યક્તિગત, વ્યવસાયિક, માનસિક અને સાંબેદિક વિકાસ માટે.
5. કારકિર્દીના ઘડતર માટે.
6. ભાવિ સમસ્યાઓના ઉકેલ માટે.
7. ભાવિ પડકારો જીલવાની ક્ષમતા વિકસાવવા.
8. કાર્યક્ષમ અને કુશળ નાગરિક બનાવવા માટે.
9. જીવનમાં આવનાર તકોને ઓળખવા તેમજ તેનો લાભ ઉઠાવવા.
10. ભાવિ નિર્ણયો લેવવામાં સક્ષમ બનાવવામાં
11. મનુષ્ય અવતારને સાર્થક બનાવવા માટે.

## ૫. મહત્વના જીવન કૌશલ્યો

મનુષ્યને જીવન જીવવા માટે અનેક કૌશલ્યો હસ્તગત કરવા પડતા હોય છે. દરેક મનુષ્ય બધાં જ કૌશલ્યો હાંસિલ કરી શકતો નથી. પરંતુ કેટલાંક મહત્વના કૌશલ્યો જો હાંસિલ કરે તો પણ માણસ પોતાના જીવનમાં નાસીપાસ થતો નથી અને પોતાનું જીવન સરળતાથી જીવી શકતો હોય છે. આમ, તો જીવન કૌશલ્યો ઘણા બધા છે અને બધા કૌશલ્યોની જરૂર જીવનના દરેક તબક્કા પર પડતી હોય છે. તેમાંના કેટલાંક મહત્વનો કૌશલ્યોની ચર્ચા અતે કરવામાં આવી છે.

## ૫.૧ સમસ્યા ઉકેલ કૌશલ્યો:-

વિદ્યાર્થી શાળા કોલેજ દરમિયાન પણ ઘણી બધી સમસ્યાનો સામનો કરે છે. આ સમસ્યાઓ તેના જીવનને લાગતી પણ હોય છે અને શિક્ષણને લાગતી પણ હોય છે. વિદ્યાર્થી પણ પરિવારનો સભ્ય હોય છે એટલે પરિવારમાં ઉદ્ભવતી સમસ્યા પણ તેને માટે મહત્વની હોય છે કારણકે તેની અસર તેના ભણતર પણ પડતી હોય છે. તે ઉપરાંત પરીક્ષાને લાગતી સમસ્યા, અનુકૂલનને લાગતી સમસ્યા, શારીરિક સમસ્યા, આર્થિક સમસ્યા વગેરે જેવી સમસ્યાઓને તે ઓળખતો થવો જોઈએ. આ સમસ્યાઓને ઓળખ્યા બાદ તેના ઉદ્ભવવાના કારણો અને સંભવિત ઉપાયોની વિચારણા કર્યા બાદ ઉપાયો અજમાવી શકતો હોવો જોઈએ અને ત્યારબાદ અજમાવેલ ઉપાયો કેટલા કારગત નીવડ્યા તેનું મૂલ્યાંકન કરતો થવો જોઈએ. આ રીતે તેનામાં સમસ્યા ઉકેલનું કૌશલ્ય વિકસાવી શકાય વિદ્યાર્થી માનસિક રીતે સમસ્યાઓના ઉકેલ માટે સજજ થઈ જાય છે.

## ૫.૨ પ્રત્યાયનનું કૌશલ્યો:-

આ અંતર્ગત વિદ્યાર્થી પોતાના વિચારો અન્યો સમક્ષ સારી રીતે રજુ કરતો થવો જોઈએ. વિદ્યાર્થી વર્ગખંડના શિક્ષણકાર્ય દરમિયાન શિક્ષક દ્વારા પૂછાયેલા પ્રેષનના ઉત્તર આપવામાં તથા વર્ગખંડમાં ભણાવતા વિષયમાં પોતાના વિચારો મુક્તરીતે રજુ કરી શકે તે રીતે તૈયાર કરવો જોઈએ. વિદ્યાર્થી પોતાના વિચારો મુક્તરીતે રજુ કરી શકે તેવું વાતાવરણ વર્ગખંડમાં અને શાળા કોલેજની પ્રવૃત્તિઓ દ્વારા ઉભું કરવું જોઈએ. તેના વિચારો શાળાની કે કોલેજોની દિવાલોમાં દબાઈ જવા જોઈએ નહિં શીખવનારે એ ધ્યાન રાખવું જોઈએ કે વિદ્યાર્થી કોશી સ્લેટ નથી અને તેમાં પણ જ્ઞાન સર્જિત કરવાની ક્ષમતા રહેલી છે. તેથી વિદ્યાર્થીઓની રજૂઆત વધુ ને વધુ થાય તેવું વાતાવરણ તૈયાર કરી તેની અંદર રહેલી લઘુતા ગ્રંથિને દુર કરવી જોઈએ. વળી, આપણા દેશો લોકશાહી પ્રણાલીને અપનાવેલી હોવાથી પોતાના



વિચારોની સ્વતંત્રતાના હક્કનું રક્ષણ થાય છે તે માટે પણ તેના વિચારો રજૂ કરતો કરવો એ શિક્ષણ આપનારની ફરજમાં આવે છે.

આ કૌશલ્ય અંતર્ગત વિદ્યાર્થીને એકસાથે શ્રોતાપણ બનાવવાનો છે. જો તે સારો શ્રોતા હશે તો જ તે સારો વક્તા બની શકેશે. વિદ્યાર્થી પોતાના મંત્રયો અને પ્રતિભાયો આપી શકતા હોવો જોઈએ. વિદ્યાર્થી કોઈ વિષય પર શાખા કે કોલેજમાં તથા અન્ય જગ્યાઓ પર વક્તવ્ય આપી શકે તે રીતે તૈયાર કરવો જોઈએ. તેનામાં શાલ્ફિક-અશાલ્ફિક બંને રીતે વાત રજૂ કરતા આવડવી જોઈએ.

## ૫.૩ ચિંતનાત્મક અને વિવેચનાત્મક વિચારસરણી:-

કોઈપણ ઘટના, બનાવ કે માહિતી વિશે વિદ્યાર્થી પોતાની રીતે વિચારી શકે તેવી ક્ષમતા વિકસવી જોઈએ કોઈપણ પણ બાબતને સીધી સ્વીકારતા પોતાને તે અંગે વિચારતો થવો જોઈએ. વળી વિચાર કર્યા બાદ તેની વિવેચના પણ તેણે કરવાની હોય છે. વર્ગખંડમાં શિક્ષક કોઈ બાબતની રજૂઆત કરે ત્યારે તેણે પોતાની રીતે વિચારીને પોતાનો દાખિકોણ રજૂ કરવો જોઈએ. માત્ર વિરોધ કરવા ખાતર પોતાના વિચારો રજૂ નથી કરવાના પણ તેમાં કોઈ રચનાત્મક અથવા તો વિશિષ્ટપણું હોવું જોઈએ. અન્યના વર્તનને નિહાળી તેનું વિશ્લેષણ કરી સારી -નરમી બાબતો તારવી શકતો હોવો જોઈએ. પોતે શા માટે ભરખી રહ્યો છે. ભરખીને શું કરવાનું છે વગેરે જેવી બાબતો ભવિષ્યને ધ્યાનમાં રાખીને વિચારતો થાય એ જરૂરી છે. દેશ-દુનિયામાં કે સમાજમાં બનતી દરેક ઘટનાઓ વિશે વિવેચનાત્મક વિચારણી વિકસાવે તે જરૂરી છે. કારણકે ભવિષ્યમાં તેણે અનેક બનાવ કે ઘટનાનાં અંગે સાક્ષી બનીને સાચાનો પક્ષ લેવાનો છે. પોતે દેશનો અને પરિવારનો જવાબદાર નાગરિક બનવાનો છે તે અંગે ધ્યાન રાખી વર્તમાન સમસ્યાઓ અને ઘટનાઓ અંગે ચિંતન કરે તે પણ જરૂરી છે.

## ૫.૪ સર્જનાત્મક વિચારસરણી :-

આજના યુગમાં ખૂબ જ ઝડપથી પરિવર્તનો આવી રહ્યા છે. જ્ઞાનના ક્ષેત્રો વિશાળ બનવા પાડ્યા છે તેથી અનેક ક્ષેત્રોમાં પરિવર્તન આવી રહ્યા છે. દરેક ક્ષેત્રોમાં કંઈકને કંઈ સર્જનાત્મકતા જોવા મળે છે. ટેકનોલોજીની, ફેશન, ખોરાક, મકાન, દરેક ક્ષેત્રોમાં નવા નવા ઈનોવેશન થતા રહે છે. રોજ રોજ નવી આઈડિયાઓ આવતી રહે છે. આથી બ્યક્ટિટએ પોતાનામાં રહેલી સર્જનશક્તિને વિકસાવવી જ રહી. શિક્ષણ મેળવેલ ન હોય તેવા અનેક લોકોમાં પણ બહુજ સર્જનશીલતા પડી હોય છે. કુદરતમાં અનેકવિધ સંભાવનાઓ અને શક્તિઓ પડેલી છે. વિદ્યાર્થી પોતાનું સ્વ-મુલ્યાંકન કરતો થાય અને પોતાની શક્તિઓ વિશે જાણે તે ખૂબ જ જરૂરી છે. પોતાની શક્તિઓને યોગ્ય માર્ગ વાળમાં આવે તો ઝડપી સારી સર્જનાત્મકતા વિકસાવી શકાય છે તેમજ જો નિષ્ફળતાઓને પણ યોગ્ય માર્ગ વાળવામાં આવે તો સર્જનતા વિકસિત હોય છે. એક ક્ષેત્રની નિષ્ફળતા બીજા ક્ષેત્રમાં અપાવી શકે. તે દિશામાં કામગીરી કરી સફળતા પ્રાપ્ત કરી શકતી હોય છે.

## ૫.૫ નિર્ણયિકરણ :-

જીવનમાં સફળતાનો આ પણ મંત્ર છે. તગઢત દર્શાવાન દ્વારા રાગઢત તામદ્દ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય જો લેવામાં આવે તો તેનાથી સફળતા પ્રાપ્ત કરી શકતી હોય છે. વિદ્યાર્થીમાં નિર્ણયિકરણની શક્તિ વિકસે તે ખૂબ જ



જરૂરી છે. કારણ કે જીવનમાં દરેક તબક્કા પર તે મહત્વના નિર્ણયો લેવાના હોય. તેની સમક્ષ અનેક વિકલ્પો હથે તેમાંથી યોગ્ય વિકલ્પની પસંદ કરવા અંગેની આવડત તેનામાં કેળવાવી જોઈએ.

વળી, નિર્ણય પણ કોઈના દાખ-દબાણમાં ન લેતાં સ્વસ્થ મને લેતો થાય તે જરૂરી છે. અને લીધેલા નિર્ણયને વળગી રહેવાની તેમ જ જરૂર જણાય તો લીધેલા નિર્ણય બદલવાની આવડત પણ હોવી જોઈએ. નિર્ણયો લેવામાં જરૂર જણાતા અન્યની સલાહ લેવી તે અંગેની સમજ પણ તેણે વિકસાવવાની હોય છે. નિર્ણયો લેતી વખતે ભૂતકાળના લીધેલા નિર્ણયો વિશે પણ વિચાર કરવો પડતો હોય છે. તેમજ ઘણાં બધા વિકલ્પોમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરે તો અન્ય વિકલ્પની તુલનામાં પસંદ કરેલ વિકલ્પ અસરકારક હોવો જોઈએ. વારંવાર નિર્ણયો બદલતા રહેવું જોઈએ નહિં. અહીં એક વાત ખાસ ધ્યાન રાખવા જેવી છે કે કોઈ નિર્ણય ન લેવો તે પણ એક નિર્ણય જ છે.

## પ.૬ આંતર વ્યક્તિત્વ સંબંધ:-

વિદ્યાર્થીએ પોતાના શૈક્ષણિક જીવનબાદ સમાજનો એક જીવાબદાર નાગરિક તરીકે પણ પ્રસ્થાપિત થવાનું છે. સમાજ એ વ્યક્તિઓનો બનેલો સમૃદ્ધ છે જેમાં વિદ્યાર્થી બધા સાથે વ્યવહાર કરી સંબંધો વિકસાવવાના છે. વિદ્યાર્થી સમાજો અભિન્ન અંગ બનીને રહેવાનું હોવાથી તેણે માનવીય સંબંધ વિકસાવવા માટે તૈયાર થવાનું છે. શાળા કોલેજના જીવન દરમિયાન તેણે આ અનોખી તૈયારી કરી લેવાની હોય છે. તેણે પોતાનું વ્યક્તિત્વ કેટલેક અંશે બહિમુખી બની રહે તે રીતે વર્તન કરવું છે. વ્યક્તિ પોતે પોતાનો ભાર એકલો ઉઠાવી શકે નહિં તેથી તેણે અન્યનો સહારો પણ લેવાનો છે અને અન્યનો સહારો પણ બનવાનું છે. જો અન્યને મદદ કરશે તો જરૂર પડયે પોતાને પણ મદદ મળી રહેશે તે સમજ કેળવવાની છે. દરેક વ્યક્તિને સુખ અને દુઃખ બન્ને પરિસ્થિતિમાં લોકોના સાથની જરૂર હોય છે. તેથી વ્યક્તિ - વ્યક્તિ વચ્ચે સંબંધો બની રહેવી જોઈએ. વિદ્યાર્થીમાં નવા સંબંધો વિકસાવવાની અને જૂના સંબંધો ટકાવી રાખવાની ક્ષમતા હોવી જોઈએ.

## પ.૭ સ્વ-જાગૃત સ્વની ઓળખ :

વિદ્યાર્થી વિવિધ વિષયો દ્વારા દ્વારા દુનિયાને જાણતો પરંતુ જો તે પોતાની જાત ને જ ન ઓળખી શકતો હોય તો સફળ જીવન જીવી શકતો નથી તેથી તેણે પોતાની ક્ષમતાઓ શક્તિઓ અને નબળાઈઓથી માહિતગાર થવાનું છે. પોતાની ક્ષમતા મૂજબ જીવનના લક્ષ્યાંકો બનાવે તો નિરાશાનો ભોગ બનવું પડતું નથી. તેમજ પોતાની અંદર રહેલી શક્તિઓનો પણ કાર્ય તેનો સ્વ વિકાસ અને અન્યોના વિકાસમાં ઉપયોગ કરવો જોઈએ. વળી, એ વાત હંમેશા ધ્યાન રાખવી જોઈએ ‘Nobody is perfect in this world’ આ દુનિયામાં કોઈ વ્યક્તિ સંપૂર્ણ હોતો નથી. દરેક વ્યક્તિમાં નબળાઈ કે કચાશ પડેલી હોય છે. પોતાની નબળાઈઓને જાણી તેને દુર કરવાના પ્રયત્ન કરવા જોઈએ.

પોતાને શું ગમે અને શું નથી ગમતું તે અંગેની જાણકારી હોવી જોઈએ. પોતાને ગમતું હોય તેની સાથે તો સાયુજ્ય તરત સ્થાપી શકાય પરંતુ કેટલીકવાર ન ગમતું હોય ત્યારે પણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જીવન જીવતા આવડવું જોઈએ.



હું કોણ છું? આ પ્રશ્નનો જવાબ તેને ભીતરથી મેળવતા આવડવો જોઈએ. પોતાની ઈચ્છાઓ, આકંસાઓ અને સપનાઓથી માહિતગાર હોવો જોઈએ અને તેને પૂરા કરવા માટે પોતાને ઓળખી જવનમાં તે પૂરા કરવા માટેની ક્ષમતા કેળવવી જોઈએ.

## પ.૮ સહાનુભૂતિ :-

વિશ્વમાં રોજેબરોજ અનેક અનેક ઘટનાઓ, બનાવો, અક્ષમાતો સર્જતા હોય છે. આવા સમયે તેમજ વ્યક્તિના જીવનમાં આવનારા દુઃખ પ્રસંગોએ લોકોની સાથે કેવી રીતે સહાનુભૂતિ રાખવી તે વ્યક્તિને આવડવું જોઈએ. નરસિંહ મહેતાનું ખૂબ જ પ્રચલિત અને ગાંધીજીને પ્રિય એવું વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પડાઈ જાણે રે આ પંક્તિમાં પ્રસ્તુત કૌશલ્ય અંતર્ગત સમજૃતી આપવા ખૂબ જ મહત્વનું છે. વળી, વ્યક્તિએ અન્ય વ્યક્તિ સાથે તો સહાનુભૂતિ રાખવાની હોય છે. પરંતુ તે સાથે પરિવાર, સમાજ, દેશ અને વિશ્વ સાથે તેમ જ પશુ-પંખી, જંગલો, તળાવો વગેરે પ્રાણીક સહાનુભૂતિ પણ દાખવવાની હોય છે. અન્ય વ્યક્તિને તે પોતે છે તે રીતે જોવાની રીત કેળવાય તો સહાનુભૂતિ આપોઆપ કેળવાય જતી હોય છે.

## પ.૯ તાણ, ચિંતા અને દબાણજન્ય પરિસ્થિતિમાં સંતુલન :-

વ્યક્તિ જીવન દરમિયાન સુખ અને દુઃખની અનુભૂતિ કરતો રહેતો હોય છે. તેમાંય જો દુઃખની ઘડી આવી પડે કે નિષ્ફળતા મળે કે પોતાનું ધારેલું ન થાય તો તે તાણા, ચિંતા કે દબાણ જેવી માનસિક બાબતોનો શિકાર બનતો હોય છે. વળી, આ બધી માનસિક બાબતોની શારીરિક અસરો પણ જોવા મળે છે અને લાંબાગાળે વ્યક્તિને ખૂબ જ નુકસાનકર્તા બની શકે છે. વિદ્યાર્થીને પરીક્ષાનું ટેન્શન હોય, વાંચવાનું ટેન્શન હોય, ભવિષ્યની નોકરીનું ટેન્શન હોય કે અન્ય કોઈ બાબતની ચિંતા હોય તો તેવા સંજોગોમાં કઈ રીતે રહેવું. તે તેને શીખવવાનું છે. પરીક્ષામાં કે અન્ય કોઈ પણ બાબતમાં નિષ્ફળ જાય તો કઈ રીતે પોતાને સાચવવું તે તેણે શીખવવાનું હોય છે. જીવનમાં સમય કદી એક સરખો રહેતો નથી અને નિષ્ફળતા પણ કાયમની હોતી નથી તેવું જણાવી તેનામાં રહેલી નિરાશાને ખંખેરી નંખાવી જીવનમાં સંતુલન જાળવતા શીખવવાનું છે.

આજના સ્પર્ધાત્મક યુગમાં માનસિક સ્વાસ્થ્ય જાળવવાનું ખૂબ જ મૂર્ખેલ થઈ રહ્યું છે. વળી, ભौતિકતા તરફની દોડ પણ ચિંતાજનક છે. ત્યારે મહાત્માઓના ચરિત્ર દ્વારા જીવન જીવના બોધપાઠો દ્વારા વિદ્યાર્થીનું શારીરિક સ્વાસ્થ્યની સાથે માનસિક સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે તે પણ શાળા કોલેજોમાં ધ્યાન લેવાય તે જરૂરી જોઈએ.

## પ.૧૦ હકારાત્મક અને વૈજ્ઞાનિક દસ્તિકોણ:-

અનેક નિરાશાઓમાં એક આશા આ વાત વિદ્યાર્થીના જીવનમાં ઉતારવી જોઈએ. વિદ્યાર્થીઓ નિષ્ફળતા મળતા કે મૂર્ખેલી કે તકલીફવાળી પરિસ્થિતિમાં નિરાશ થઈ જતા હોય તો આવા સમયમાં ઉપરોક્ત યુક્તિ દ્વારા તેનો દસ્તિકોણ હકારાત્મક રહે તે માટે ખૂબ જ જરૂરી છે. વ્યક્તિનો અન્ય વ્યક્તિ સાથે, પરિવાર, સમાજ, દેશ, વિશ્વ સાથે આવનાર ભવિષ્ય વિશે પણ હકારાત્મક દસ્તિકોણ રાખતા વિદ્યાર્થીઓને શીખવવું જોઈએ. ઉપરાંત તેને દસ્તિકોણ વૈજ્ઞાનિક પણ હોવો જોઈએ. કોઈપણ બાબતને સ્વીકારતા પહેલા પરિક્ષણના એરણ પર ચકાસીને તેને સમજતો કરવો જોઈએ. પરીક્ષામાં એક વાર કે બે વાર કે ત્રણ વાર નિષ્ફળ જાય તો પણ તેનો આત્મવિશ્વાસ ન ડાંનું ધ્યાન



રાખવું જોઈએ. અનેક સફળ વ્યક્તિઓએ જીવનમાં ધણી બધી નિષ્ઠળતાઓ જોયેલી હોય છે. જે અંગેની જાણકારી આપી વિદ્યાર્થીમાં હિન્મત અને આત્મવિશ્વાસ જળવાઈ રહે તે ધ્યાન રાખવું જોઈએ.

## ૬. ઉપસંહાર :-

ઉપરોક્ત જીવન કૌશલ્ય અને જીવન કૌશલ્ય શિક્ષણની સંકલના અને વિવિધ જીવનમાં કૌશલ્ય વિશે જાણ્યા પછી અંતે શિક્ષણક્ષેત્રે વિદ્યાર્થીઓમાં વિવિધ જીવન કૌશલ્યોનો વિકાસ થાય તે પણ ખૂબ જ જરૂરી છે. કારણ કે તેના જીવનની સફળતા-નિષ્ઠળતાનો આધાર તેના જીવન કૌશલ્યો પર છે. વ્યક્તિ જો જીવન કૌશલ્યો ધરાવતો ન હોય તો ગમે તેટલો પૈસાદાર કે ઉચ્ચ હોદા પર બીરાજતો હોય તો પણ નાસીપાસ કે પછાડવાની શક્યતાઓ રહેલી હોય છે. તેથી જીવનમાં ઉદ્ભવતી સમસ્યાઓ, સંઘર્ષો, પડકારો સામે ઝડૂમવાની શક્તિ અને ઉજાળા અને આશાઓથી ભરપૂર ભવિષ્યનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓને તૈયાર કરવા તેવી પ્રાર્થના સાથે અસ્તું.



## સંદર્ભસૂચિ

- દવે, જે.કે (૨૦૦૧). *વિકસતા ભારતમાં શિક્ષણ અને શિક્ષક*. અમદાવાદ : બી.એસ.શાહ પ્રકાશન.
- દેસાઈ એચ.જી (૧૯૮૮). *સંશોધન અહેવાલ. રાજકોટ* : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી.
- પટેલ જે.ડી (૨૦૦૪) *વિકસમાન ભારતીય સમાજમાં શિક્ષણ* : નિરવ પ્રકાશન અમદાવાદ.
- શાસ્ત્રી જ્યોતિન્દ્ર દવે શિક્ષણની સમાજ શાસ્ત્રીય આધારશીલાઓ, યુનિવર્સિટી ગ્રંટ નિર્માણ બોર્ડ